



JAI SHREE RAM

**TEMPLE SHREE RAMJI MANDHATA**

INCORPORATED 1992

CHARITÉ CANADIENNE ENREGISTRÉE / REGISTERED CANADIAN CHARITY

8155, RUE DUROCHER, MONTREAL, QUEBEC H3N 2A8

TEL.: (514) 277-9298



શુક્રવાર, તા.૧૦મી એપ્રિલ, ૨૦૧૯

આદરણીય વડીલો, ભાઈઓ અને બહેનો,

સવિનય જણાવવાનું કે તા.૨૮મી એપ્રિલ, ૨૦૧૯નાં દિવસે, રાખવામાં આવેલ વર્ષ ૨૦૧૮ની વાર્ષિક જાહેરસભા સંવિધાન મુજબ નક્કી કરેલ કોરમ ન થતાં મુલતવી રાખવામાં આવી હતી, જે આપણા સર્વના માટે એક દુઃખદ બાબત છે. વર્ષ દરમ્યાન માત્ર એક દિવસ ત્રણથી ચાર કલાક સર્વે આજીવન સભ્યો આ વાર્ષિક જાહેરસભામાં ભાગ લે અને એજન્ડા મુજબ જરૂરી ચર્ચામાં ભાગ લઈ પોતાના સલાહ સૂચનો આપી સંસ્થાના વહીવટમાં પોતાનો સહયોગ આપે એવી નમ્ર વિનંતી છે. સંસ્થાના બંધારણ મુજબ આ મુલતવી રાખવામાં આવેલી સભા ફરીથી એકવાર રવિવાર તા. ૨૬મી મે નાં રોજ બપોરે, ૩:૦૦ કલાકે મળશે જેમાં નોટિસમાં જણાવેલ એજન્ડાઓ ઉપર ચર્ચા વિચારણા કરી એ બાબતે નિર્ણય લેવાનાં રહેશે. સભામાં આપ સર્વેને સમયસર ઉપસ્થિત રહેવાની નમ્ર વિનંતી છે.

આ વર્ષે આપણા મંદિરનાં પાટોત્સવની પૂજામાં “રૂદ્ર યાગ”નું આયોજન રાખેલ છે. જેમ ભગવાન શ્રી વિષ્ણુનાં અવતારો થયા તેમ ભગવાન શિવજીનાં પણ અનેકો અવતારો થયા છે. “રૂદ્ર” એ ભગવાન શિવજીનું જ સ્વરૂપ છે. આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવના “રૂદ્ર” અવતારનું સુંદર વર્ણન મળે છે. લીંગપુરાણ અનુસાર સૃષ્ટિના ચક્રને તીવ્ર ગતિ આપવા માટે ભગવાન શિવે સ્વયં અમર તથા શક્તિશાળી રૂપ ધારણ કર્યું હતું. “રૂદ્ર” શબ્દમાં “રૂ” એટલે ચિંતા અને “દ્ર” એટલે દૂર કરવું. આમ “રૂદ્ર” નો અર્થ ચિંતા અને સમસ્યાઓથી મુક્તિ આપનાર એવો થાય. ભગવાન શિવનું “રૂદ્ર” સ્વરૂપ આપણા જીવનનાં તમામ દુખો અને ચિંતાઓને દૂર કરનાર છે. ઋગ્વેદ અને યજુર્વેદમાં ભગવાન “રૂદ્ર”ને સ્વર્ગ અને પૃથ્વી ઉપર વસેલી દુનિયાનાં ઇષ્ટદેવ ગણવામાં આવ્યાં છે.

## પાટોત્સવનો વિગતવાર કાર્યક્રમ

શનિવાર, તા. ૨૨મી જુન ૨૦૧૯

- દૈનિક આરતી: સવારે ૮:૦૦ કલાકે
- શ્રી શિવજીનો “રૂદ્ર” યાગ: સવારે ૯:૦૦ થી ૧૧:૦૦ સુધી.
- ઉછમણી: સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ દરમ્યાન આપણા મંદિરમાં બિરાજમાન (શ્રી રામ દરબાર સિવાય) સમસ્ત દેવી-દેવતાઓ તેમજ સંતોનાં પદ્મભિષેક માટે ઉછમણીનો કાર્યક્રમ.
- પદ્મભિષેક પૂજન: બપોરે ૨:૩૦ થી ૩:૦૦ દરમ્યાન પદ્મભિષેકમાં ભાગ લેનાર ભક્તજનો તરફથી સામુહિક પૂજન.
- મહા આરતી: ૩:૩૦ થી ૫:૦૦ દરમ્યાન પ્રથમ શ્રી “સુંદરકાંડ”નું પારાયણ અને ત્યારબાદ વિશેષ મહા આરતી સંપન્ન થાશે.
- મહાપ્રસાદનું વિતરણ: બપોરે ૧૨:૩૦ થી ૧:૩૦ અને સાંજે મહા આરતી પછી.

આ વર્ષે પાટોત્સવના મુખ્ય યજમાન માટે \$૭૦૦૧નું અનુદાન મંદિરનાં લાભાર્થે નક્કી કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય પૂજા, શ્રી રામદરબારનો પદ્મભિષેક, મહાપ્રસાદનાં વિતરણનો લાભ અને મુખ્ય હવનકુંડમાં આહુતીના લાભનો સમાવેશ થાય છે. સહ યજમાન માટે \$૧૦૧ અનુદાન સ્વરૂપે આપવાના રહેશે. જેમાં સામુહિક પૂજા સાથે સામુહિક રૂપે યજ્ઞમાં આહુતિ આપવાનો લાભ મળશે. સહ યજમાન બનવા ઈચ્છા ધરાવતા ભક્તજનોને મંદિરના મહારાજ શ્રી નો સંપર્ક સાધવા વિનંતી.

**રવિવાર ૨૩મી જૂન, ૨૦૧૯**

૧. આનંદબજાર મેળાનું આયોજન: પાટોત્સવની ઉજવણીનાં ભાગ રૂપે આનંદબજારનું આયોજન મંદિરના પ્રાંગણમાં લગાવવામાં આવેલ ટેન્ટમાં સાંજે ૫:૦૦ કલાકે કરવામાં આવશે. પોતાની મનગમતી સ્વાદિષ્ટ વાનગિઓના વેચાણનો સ્ટોલ લગાવવા માટે સર્વ શ્રી કિશોરભાઈ આર. ૫૧૪-૮૨૩-૩૮૧૩, જયેશભાઈ ડી. ૫૧૪-૨૯૯-૧૫૭૦, રમેશભાઈ સી. ૫૧૪-૨૯૯-૧૦૯૬, જગદિશભાઈ એન. ૫૧૪-૮૨૭-૩૯૩૦નો સંપર્ક સાધવા નમ્ર વિનંતિ. રાત્રે ૮:૦૦ કલાકે DJ Rockyનાં સથવારે “રાસ-ગરબા”નો રંગારંગ કાર્યક્રમ સંપન્ન થાશે.

### કથાની વિગતવાર માહિતી:

આ વર્ષે શ્રી રાજેન્દ્રગીરી ગોસ્વામી, ભાવનગરથી “શ્રી દેવિ ભાગવત પૂરાણ”ની કથા શ્રવણ કરાવવા માટે આવેલ રહ્યા છે. ગુજરાતી ભાષામાં સંગીતમય કથાના આયોજનની માહિતી નિચે મુજબ છે.

- કથા તા. ૬થી જુલાઈ થી ૧૪મી જુલાઈ દરમિયાન સંપન્ન થાશે. શનિવારે તથા રવિવારે કથાનો સમય સાંજે ૪:૩૦ થી ૮:૩૦ સુધી તેમજ સોમવારથી શુક્રવાર દરમિયાન સાંજે ૬:૩૦ થી ૮:૩૦ સુધીનો રહેશે.
- કથાના મુખ્ય યજમાન માટે \$૭૦૦૧, વિશિષ્ટ યજમાન માટે \$૨૦૧ અને દૈનિક આરતી માટે \$૫૧નું અનુદાન મંદિરના આર્થિક લાભાર્થે રાખવામાં આવ્યું છે.
- દરરોજ કથા વિરામ બાદ મહાપ્રસાદનો લાભ આપવામાં આવશે. જેના માટે \$૧૦૦૧ દાન સ્વરૂપે રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી આટ ગામના વ્યક્તિઓ તરફથી અને અમલસાડ વિભાગ તરફથી સ્વીકૃતિ મળી છે.

નોંધ: પાટોત્સવ અને કથાના યજમાન બનવા માટે પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ આર. ૫૧૪-૩૮૯-૦૧૮૧, શ્રી અરવિંદભાઈ બી. ૫૧૪-૬૮૮-૯૧૪૨, શ્રીમતિ દમયંતીબેન ડી. ૫૧૪-૪૮૫-૧૬૦૬ નો સંપર્ક સાધવા નમ્ર વિનંતી.

પ્રમુખ શ્રી

ઈશ્વરલાલ આર, પટેલ



514-389-0181/ishwar.nila@gmail.com

આભાર સહિત,  
કાર્યવાહક સમિતિ વતી

મંત્રી શ્રી

યોગેશ સી. પટેલ



514-815-9701/ypatel@skylawn.net